

**MS-109**  
**December-2016**  
**M.Com., Sem.-I**  
**403 : Marketing Management**

Time : 3 Hours]

[Max. Marks : 70]

- સૂચના : (1) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.  
(2) દરેક પ્રશ્નનાં ગુણ જમણી બાજુ દર્શાવેલ છે.

1. (A) સામાજિક માર્કેટિંગ ખાત સમજાવો.

7

અધ્યાત્મ

એકવીસમી સદીમાં કંપનીઓ કેવી રીતે બદલાઈ રહી છે ?

- (B) ટ્રૂકમાં જવાબ લખો : (ગમે તે બે)

4

- (1) સંબંધ માર્કેટિંગ એટલે શું ?

- (2) જરૂરિયાત (નીડ) અને ઈચ્છાઓ (વોન્ડ) વચ્ચેનો તફાવત દર્શાવો.

- (3) માર્કેટિંગ અંકુશનાં નજી પ્રકારો જણાવો.

- (C) એક-બે વાક્યોમાં જવાબ લખો :

3

- (1) માર્કેટિંગ પ્રક્રિયાની વાખ્યા લખો.

- (2) ગ્રાહક સંતોષ એટલે શું ?

- (3) પાંચ પ્રકારની જરૂરિયાતો જણાવો.

2. (A) સંદર્ભ જૂથો એટલે શું ? સંદર્ભ જૂથો વર્તનને કેવી રીતે અસર કરે છે ?

7

અધ્યાત્મ

બજાર વિભાજનનાં આધારો સમજાવો.

4

- (B) ટ્રૂકમાં જવાબ લખો : (ગમે તે બે)

- (1) પોસ્ટિશનિંગ એટલે શું ?

- (2) હરીકોને કેવી રીતે ઓળખી શકાય ?

- (3) બજાર સંશોધન પ્રક્રિયાના તબક્કા જણાવો.

3

- (C) એક-બે લિટીમાં જવાબ લખો :

- (1) ગ્રાહક વર્તશૂકનાં અન્યાસનું મહત્ત્વ જણાવો.

- (2) ખરીદી નિર્ણય પ્રક્રિયાનાં તબક્કા જણાવો.

- (3) હરીકોના પ્રતિક્રિયાનાં પેટર્ન (પ્રકારો) જણાવો.

P.T.O.

3. (A) નવી પેદાશ વિકાસ પ્રક્રિયામાં ખ્યાલ વિકાસ અને પરીક્ષણ સમજાવો.

7

અથવા

અસરકારક માહિતી સંચારનાં વિકાસનાં તબક્કાઓ સમજાવો.

(B) ટૂંકમાં જવાબ લખો : (ગમે તે બે)

4

(1) નવી પેદાશ વિકાસનાં પડકારો જણાવો.

(2) ગ્રાહક સ્વીકૃતિ પ્રક્રિયાનાં તબક્કાઓ જણાવો.

(3) કંપનીઓ પોતાનો અભિવૃદ્ધિ (પ્રમોશન) બજેટ કેવી રીતે નક્કી કરે છે ?

(C) એક-બે લીટીમાં જવાબ લખો.

3

(1) જાહેરાતનાં કાર્યો જણાવો.

(2) રેખા વિસ્તરણ એટલે શું ?

(3) બ્રાન્ડ એટલે શું ?

4. (A) સેવા એકમોમાં બંધબેસતાં માંગ અને પૂરવઠા માટેની વ્યૂહરચનાઓ સમજાવો.

7

અથવા

આંતરરાષ્ટ્રીય માર્ક૆ટરને ઉપલબ્ધ વિવિધ પ્રકારની બજાર પ્રવેશ પદ્ધતિઓ સમજાવો.

(B) ટૂંકમાં જવાબ લખો : (ગમે તે બે)

4

(1) પેદાશ અનુકૂલન એટલે શું ?

(2) આંતરરાષ્ટ્રીયકરણ પ્રક્રિયાનાં તબક્કાઓ જણાવો.

(3) સેવા મિશ્રનાં જુદા વગ્નો જણાવો.

(C) એક-બે લીટીમાં જવાબ લખો.

3

(1) સેવાની વ્યાખ્યા લખો.

(2) સેવામાં પરસ્પર સંવાદ માર્કેટિંગ એટલે શું ?

(3) ફેન્ચાઇઝિંગ (Franchising)નાં લાભ જણાવો.

5. સાચાં વિકલ્પની પસંદગી કરો :

14

(1) આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કંપની કેટલાક મુખ્ય નિર્ણયોનો સામનો કરે છે. આમાનું સર્વપ્રથમ નિર્ણય છે

(a) આંતરરાષ્ટ્રીય કષાએ જવું કે નહિ

(b) વૈશ્વિક માર્કેટિંગ પદ્ધતિના પર નજર નાખવી

(c) કયા બજારોમાં પ્રવેશ કરવું

(d) કેવી રીતે બજારમાં પ્રવેશ કરવું

(2) \_\_\_\_\_ એટલે કોઈ કેરફાર કર્યા વગર પેદાશને વિદેશી બજારમાં ૨૫ કરવી.

(a) સીધા વિસ્તરણ

(b) પેદાશ અનુકૂલન

(c) માહિતી સંચાર અનુકૂલન

(d) જ્વાલ અનુકૂલન

- (3) \_\_\_\_\_ ગ્રાહકોને માટે સેવા તૈપાર કરવી, ભાવ, વિતરણ અને અભિવૃદ્ધિનું સામાન્ય કામ વણવે છે.
- (a) બાળ માર્કેટીંગ
  - (c) પ્રત્યક્ષ માર્કેટીંગ
  - (b) આંતરિક માર્કેટીંગ
  - (d) ચેનલ (મુખ્યસ્થી) માર્કેટીંગ
- (4) \_\_\_\_\_ શુદ્ધ સેવાનો ઉંડાહરણ છે.
- (a) બાળક બેઠક (baby Sitting)
  - (c) રેસ્ટોરન્ટ
  - (b) એરલાઇન્સ
  - (d) ટ્રાફેસ્ટ
- (5) \_\_\_\_\_ તેમના સમુદ્દરમાં આભિપ્રાય નેતાઓ છે અને નવાં વિચારોનું ગ્રહણ વહેલાં પરંતુ કાળજીપૂર્વક કરે છે.
- (a) સર્જકો
  - (c) શરૂઆતમાં મોટા ભાગનાં
  - (b) જલ્દી સ્વીકારનારાઓ
  - (d) અંતમાં મોટા ભાગનાં
- (6) માર્કેટર્સ ઘણી વખત \_\_\_\_\_ શબ્દનો ઉપયોગ ગ્રાહકોનાં વિવિધ જીથોને આવરી લેવા માટે કરે છે.
- (a) લોકો
  - (c) ઉઘ્યોગ
  - (b) બજાર
  - (d) ડેમોગ્રાફી (વસ્તી-વિષયક)
- (7) \_\_\_\_\_ ખ્યાલ ધરાવે છે કે ગ્રાહકો તે પેદાશોની તરફેણ કરશે જે સૌથી વધુ ગુણવત્તા કામગીરી અથવા નવીનીકરણ વિશેપતાઓ પ્રદાન કરે.
- (a) પેદાશ
  - (c) માર્કેટીંગ
  - (b) ઉત્પાદન
  - (d) વેચાણ
- (8) બજાર વિભાજન વિશ્વેષણ વખતે, માર્કેટર \_\_\_\_\_ સેંમેન્ટ્સ ઓળખે છે જે સૌથી વધુ તકો દર્શાવે છે.
- (a) લક્ષ્ય બજાર
  - (c) ધ્યાનકેન્દ્રિત બજાર
  - (b) પ્રાથમિક બજાર
  - (d) વસ્તીવિષયક બજાર
- (9) \_\_\_\_\_ પદ્ધતિ એકમનાં પ્રમોશન બજેટને હરીકોનાં બજેટ સાથે મેળ કરીને સુયોજિત કરે છે.
- (a) પોસાય
  - (c) સ્પર્ધાત્મક સમાનતા
  - (b) વેચાણની ટકાવારી
  - (d) ઉદેશ અને કાર્ય
- (10) નિર્દેશી બજારમાં \_\_\_\_\_ માર્કટે સૌથી વધુ સંડોવણી આંતરરાષ્ટ્રીય માર્કેટરની થાય છે.
- (a) નિકાસ
  - (c) લાઈસેન્સિંગ
  - (b) સંયુક્ત સાહસ
  - (d) પ્રત્યક્ષ (સીધું) રોકાણ
- (11) વસ્તુઓની કુલ સંખ્યા જે કંપની પોતાની પેદાશ રેખાઓની અંદર વહન કરે છે તેને પેદાશ મિશ્રની \_\_\_\_\_ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
- (a) પહોળાઈ
  - (c) લંબાઈ
  - (b) ઊડાઈ
  - (d) સુસંગતતા

- (12) \_\_\_\_\_ જરૂરિયાત છે જે પૂર્તા ગ્રમાણમાં દવાઈને વર્કાનું તંત્ર કંઠાંગ માટે દિશામાન કરે છે.
- (a) હેતુ (Motive) (b) હિંદ્રા (Want)  
(c) માગ (Demand) (d) મૂલ્ય (Value)
- (13) નીચેમાંનો કયો તબક્કો ગ્રાહક નિર્ધાર્ય પ્રક્રિયાનો તબક્કો નથી ?
- (a) જરૂરિયાત ઉદ્ભબ (b) બ્રાન્ડ એપ્લિય  
(c) માહિતી શોધ (d) ખરીદ નિર્ધાર્ય
- (14) \_\_\_\_\_ અવી પ્રથા છે જે નાના બજારના મોટા હિસ્સાની પાછળ જાય છે.
- (a) સમાન માર્કેટિંગ (b) અયગ માર્કેટિંગ  
(c) કેન્દ્રિત માર્કેટિંગ (d) માસ માર્કેટિંગ

@geniusguruji

Seat No. : 01875

**MS-109**  
December-2016  
**M.Com., Sem.-I**  
**403 : Marketing Management**

**Time : 3 Hours]**

**|Max. Marks : 70**

**Instructions :** (1) All questions are compulsory.  
(2) Figures to the right indicate marks allotted to each question.

1. (a) Explain the societal marketing concept.

7

**OR**

How are companies changing in the twenty first century ?

- (b) Answer briefly : (any two)

4

- (i) What is relationship marketing ?
  - (ii) Distinguish between need and want.
  - (iii) State the three types of marketing control.
- (c) Answer in one-two sentences only :

3

- (i) Define marketing process.
- (ii) What is customer satisfaction ?
- (iii) State the five types of needs.

2. (a) What are Reference Groups ? How do reference groups influence behaviour ?

7

**OR**

Explain the basis for segmenting market.

4

- (b) Answer briefly : (any two)

- (i) What is positioning ?
- (ii) How can competitors be identified ?
- (iii) State the steps in marketing research process.

- (c) Answer in one-two sentences only :

3

- (i) State the importance of the study of consumer behaviour.
- (ii) State the steps in buying decision process.
- (iii) State the reaction patterns of competitors.

5

**P.T.O.**

3. (a) Explain concept development and testing in new product development process.

OR

Explain the steps in development of effective communication.

7

(b) Answer briefly : (any two)

(i) State the challenges in new product development.

(ii) State the stages in the consumer adoption process.

(iii) How do companies decide on the promotion budget ?

4

(c) Answer in one-two sentences only :

(i) State the functions of advertising.

(ii) What is line extension ?

(iii) What is a Brand ?

3

4. (a) Explain the strategies for matching demand and supply in a service business ?

7

OR

Explain the different market – entry modes available to an international marketer.

(b) Answer briefly : (any two)

(i) What is product adaptation ?

(ii) State the stages in internationalization process.

(iii) State the categories of service mix.

4

(c) Answer in one-two sentences only :

(i) Define service.

(ii) What is interactive marketing in services ?

(iii) State the benefits of Franchising.

3

5. Choose the correct option :

14

(1) A company faces several major decisions in international marketing. The first of these decisions is \_\_\_\_\_.

(a) deciding whether to go international

(b) looking at the global marketing environment

(c) deciding which markets to enter

(d) deciding how to enter markets

(2) \_\_\_\_\_ means introducing the product in the foreign market without any change.

(a) Straight extension

(b) Product adaptation

(c) Communication adaptation

(d) Dual adaptation

- (3) \_\_\_\_\_ describes the normal work to prepare, price, distribute and promote the service to customers.
- (a) External marketing      (b) Internal marketing  
(c) Direct marketing      (d) Channel marketing
- (4) \_\_\_\_\_ is an example of pure service.
- (a) Baby sitting      (b) Airlines  
(c) Restaurant      (d) Toothpaste
- (5) \_\_\_\_\_ are opinion leaders in their community and adopt new ideas early but carefully.
- (a) Innovators      (b) Early adopters  
(c) Early majority      (d) Late majority
- (6) Marketers often use the term \_\_\_\_\_ to cover various grouping of customers.
- (a) People      (b) Market  
(c) Industry      (d) Demography
- (7) The \_\_\_\_\_ concept holds that consumers will favour those products that offer the most quality, performance or innovative features.
- (a) product      (b) production  
(c) marketing      (d) selling
- (8) During market segmentation analysis, the marketer identifies \_\_\_\_\_ segments which present the greatest opportunity.
- (a) target markets      (b) primary markets  
(c) focused markets      (d) demographic markets
- (9) The method of setting the promotion budget so as to match the budgets of the competitors is known as \_\_\_\_\_ method.
- (a) affordable      (b) percentage of sales  
(c) competitive parity      (d) objective & taste
- (10) The greatest amount of involvement of an international marketer in a foreign market comes through \_\_\_\_\_.
- (a) exporting      (b) joint venturing  
(c) licensing      (d) direct investment
- (11) The total number of items that the company carries within its product lines refers to \_\_\_\_\_ of the product mix.
- (a) width      (b) depth  
(c) length      (d) consistency

- (12) A \_\_\_\_\_ is a need that is sufficiently pressing to direct the person to seek satisfaction.
- (a) motive                          (b) want
- (c) demand                          (d) value
- (13) Which of the following is not one of the five stages of the buyer-decision process?
- (a) Need Recognition              (b) Brand Identification
- (c) Information search            (d) Purchase decision
- (14) The practice of going after a larger share of a smaller market is called \_\_\_\_\_.
- (a) undifferentiated marketing    (b) differentiated marketing
- (c) concentrated marketing        (d) mass marketing

**@geniusguruji**